


ભરૂચ જિલ્લો



- ❖ ભરૂચ જિલ્લાની ઉત્તરે વડોદરા જિલ્લાની ,દક્ષિણમાં સુરત જિલ્લાની , પૂર્વમાં નર્મદા જિલ્લાની અને પશ્ચિમમાં ખંભાતના અખાતની સરહદ આવેલી છે.
- ❖ ક્ષેત્રફળ :- ૫,૨૫૩ ચો. કિમી
- ❖ ભરૂચ જિલ્લાની આજુબાજુ નર્મદા, વડોદરા અને સુરત જિલ્લાઓ આવેલા છે.
- ❖ સ્થાપના :-૧૯૬૦
- ❖ વિધાનસભાની કુલ સીટો :- (૫) { જંબુસર, વાગરા, ઝઘડીયા (એસ.ટી),ભરૂચ અને અંકલેશ્વર}
- ❖ વસ્તી :- ૧૫,૫૦,૮૨૨(વર્ષ-૨૦૧૧)
- ❖ ક્રમ :- ૧૮મો
- ❖ સાક્ષરતા :- ૮૩.૦૩%
- ❖ વસ્તી ગીચતા :-૨૬૧ એક ચો.કિમી (વ્યક્તિ દીઠ)
- ❖ જાતિ પ્રમાણ (૧૦૦૦ પુરુષોએ) :- ૯૨૫
- ❖ મુખ્યમથક :- ભરૂચ
- ❖ હવાઈ મથક :- નથી
- ❖ તાલુકાઓ:-૯
 - (૧)ભરૂચ (૨) આમોદ (૩) અંકલેશ્વર (૪) વાગરા (૫) હાંસોટ (૬) જંબુસર(૭) ઝઘડીયા(૮) વાલિયા(૯) નેત્રંગ
- ❖ તાલુકા પંચાયતની સીટો અને બેઠકો :- ૯ (ભાજપ-૩ ,કોંગ્રેસ-૧)(કુલ બેઠકો- ૧૭૮)

(ભરૂચ-૨૮,વાગરા-૧૬, અંકલેશ્વર-૨૬, વાલિયા-૧૬,ઝઘડીયા-૨૨, હાંસોટ-૧૬, જંબુસર-૨૨,આમોદ-૧૬ અને નેત્રંગ-૧૬)

- ❖ જિલ્લા પંચાયત સીટ :- ૩૪(ભાજપ-૧૨, કોંગ્રેસ-૧૩,અન્ય-૯)
- ❖ જિલ્લા પંચાયત પ્રમુખ :-
- ❖ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :-
- ❖ નગરપાલિકાઓ સંખ્યા અને વોર્ડ :- ૩ (બેઠકો-૧૦૮) (ભાજપ-૬૮,કોંગ્રેસ-૩૬, અન્ય-૯)
(અંકલેશ્વર -૯, ભરૂચ-૧૧ અને જંબુસર -૭)
- ❖ ગામડાંઓ :-૬૬૩
- ❖ ગ્રામ પંચાયત :- ૫૪૭
- ❖ મુખ્યશહેર :- ૮, ભરૂચ
- ❖ આરટીઓ નંબર :- GJ-16
- ❖ એસટીડી કોડ નં :-૦૨૬૪૨
- ❖ નદીઓ :- નર્મદા, કરઝણ, અમરાવતી, કીમ, મેણ, ઢાઢર, ભાદર, મધુમતી ,ભૂખી
- ❖ પર્વતો :- કડિયા, ડુંગર, સારસા માતાનો ડુંગર,બાબાઘોરનો ડુંગર
- ❖ બંદરો :- ભરૂચ, દહેજ, હાંસોટ.કાવી, ટંકારી
- ❖ અમુદ્ર કિનારો :- ૧૨૭ કિ.મી (અંદાજીત)
- ❖ ઉદ્યોગો:-
રાસાયણિકખાતર, ડેરીઉદ્યોગ, રસાયણો, દવાઓ, સાયકલઉદ્યોગ, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ,ચિનાઈ માટી
ના વાસણો, સુતરાઉ કાપડ, કપાસનું જિન,કાચ ઉદ્યોગ
- ❖ ખનીજ : કુદરતી વાયુ, તેલ, ચૂનો, લિઝ્નાઈટ
- ❖ મુખ્યપાકો : કપાસ, ઘઉં, ડાંગર, કઠોળ, મગફળી, લવિંગ, કેરી, જુવાર, તુવર.
- ❖ જમીનનો પ્રકાર :- કાળી અને પીળી
- ❖ જોવાલાયક સ્થળો : શુકલતીર્થ, કબીરવડ, ભાડભૂતેશ્વર મહાદેવ, શૂલપાણેશ્વર મંદિર, મનન આશ્રમ, હઠીલા હનુમાનનું મંદિર, રતનપોળ, અલીયાબેટ સ્તંભેશ્વર, નારેશ્વર

વિશેષ નોંધ :-

- ❖ ભરૂચનો પ્રદેશ જૂના જમાનામાં લાટ તરીકે ઓળખાતો હતો.
- ❖ ભરૂચ જિલ્લામાં ૧૦૦ કિ.મી. લાંબો દરિયા કોનારો છે.
- ❖ કાનમ પ્રદેશ કપાસના પાક માટે જાણીતો છે.
- ❖ ભરૂચ નર્મદા કિનારે વસેલું શહેર છે. ભરૂચ પહેલાં ભૃગુકચ્છ નામે ધીકતું બંદર હતું.
- ❖ ભરૂચનો ગોલ્ડનબ્રિજ જુનો અને જાણીતો છે.
- ❖ ઝઘડીયા તાલુકાના રાજપારડીમાં લિઝ્નાઈટની ખાણો આવેલી છે.
- ❖ ગુજરાતનું સૌથી મહત્વનું ખનીજતેલ ક્ષેત્ર અંકલેશ્વર છે.ખનીજતેલનો ઉદ્યોગ વિકસ્યો છે.

- ❖ એશિયાની સૌથી મોટી જી.આઈ.ડી.સી. અંકલેશ્વરમાં આવેલી છે.
- ❖ ભરૂચ જિલ્લામાં ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર આવેલી છે.
- ❖ ભરૂચ જીલ્લાનો કાનમ પ્રદેશ કપાસના પાક માટે જાણીતો છે.
- ❖ નારેશ્વર ખાતે શ્રી રંગ અવધુતનો આશ્રમ આવેલો છે.
- ❖ ભરૂચમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર કોર્પોરેશન (જીએનએફસી)નું મથક આવેલું છે. જે ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું છે.
- ❖ પ્રાચીનકાળમાં ગુજરાતનું આ બંદર મારી મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું છે.
- ❖ ભરૂચ જીલ્લાની બાવાઘોરની ખાણ અકીક માટે જાણીતી છે.